

યોજનાની વિગતો તથા શરતો Details of Scheme and conditions

સ્વયં નાણા સંચાલિત યોજના (Self Finance Scheme)

(કબજો મળે ત્યાં સુધી તબક્કાવાર પુરી કિંમત ભરવાની યોજના)

(Full Payment up to handing over possession)

બહુમાળી યોજના - Multi Storied Scheme

બાંધકામ હેઠળની યોજનાનો કીમાન્ડ સર્વે :

અરજદાર જે તે યોજના માટે નીચે મુજબની આવકમર્યાદા પ્રમાણે અરજી કરી શકશે.

Applicant can apply for various schemes as per the following income criteria.

ઈ.ડબલ્યુ.એસ. યોજના માટે : સંયુક્ત વાર્ષિક આવક ₹ ૩,૦૦,૦૦૦/- સુધી

EWS upto : ₹ 3,00,000/-

એલ.આઈ.જી.૧ યોજના માટે : સંયુક્ત વાર્ષિક આવક ₹ ૩,૦૦,૦૦૦/- થી ₹ ૬,૦૦,૦૦૦/- સુધી

LIG-1 upto : ₹ 3,00,000/- to ₹ 6,00,000/-

યોજનાનું સ્થળ Location of scheme	મહેસાણા Mehsana Phase I ચાલુ યોજના	સાણંદ Sanand Phase I ચાલુ યોજના	જુનાગઢ Junagadh Phase II ચાલુ યોજના	મહુવા Mahuva Phase III ચાલુ યોજના	મહેમદાવાદ Mahemdavad Phase III ચાલુ યોજના	ગોરવા Gorva Phase II ચાલુ યોજના
ડિવિઝન Division	કાર્યપાલક ઈજનેર, અમદાવાદ / Executive Engineer, Ahmedabad		કાર્યપાલક ઈજનેર, રાજકોટ / Executive Engineer, Rajkot		કા.ઈ. વડોદરા / E.E. Vadodara	
યોજનાનું નામ Name of scheme	એલ.આઈ.જી.-૧ LIG-1	એલ.આઈ.જી.-૧ LIG-1	એલ.આઈ.જી.-૧ LIG-1	એલ.આઈ.જી.-૧ LIG-1	ઈ.ડબલ્યુ.એસ. EWS	એલ.આઈ.જી.-૧ LIG-1
કારપેટ એરીયા (ચંદાણત) Carpet Area	૩૫ ચો.મી. (૩૭૭ ચો.ફુટ) 35 sq. mts. (377 sq.ft.)	૩૩.૫ ચો ૩૫ ચો.મી. (૩૬૦ ચો ૩૭૭ ચો.ફુટ) 33.5 to 35 sq. mts. (360 to 377 sq.ft.)	૩૫ ચો.મી. (૩૭૭ ચો.ફુટ) 35 sq. mts. (377 sq.ft.)	૩૫ ચો.મી. (૩૭૭ ચો.ફુટ) 35 sq. mts. (377 sq.ft.)	૨૭ ચો.મી. (૨૯૦ ચો.ફુટ) 27 sq. mts. (290sq.ft.)	૩૫ ચો.મી. (૩૭૭ ચો.ફુટ) 35 sq. mts. (377 sq.ft.)
સગવડ Accommodation	૧ બેડરૂમ, હોલ, કીચન 1 BHK	૧ બેડરૂમ, હોલ, કીચન 1 BHK	૧ બેડરૂમ, હોલ, કીચન 1 BHK	૧ બેડરૂમ, હોલ, કીચન 1 BHK	૧ બેડરૂમ, હોલ, કીચન 1 BHK	૧ બેડરૂમ, હોલ, કીચન 1 BHK
મહત્તમ ચંદાણત કિંમત Maxi est. Cost	₹ ૭.૨૫ લાખ ₹ 7.25 Lacs	₹ ૭.૦૦ લાખ ₹ 7.00 Lacs	₹ ૭.૫૦ લાખ ₹ 7.50 Lacs	₹ ૭.૫૦ લાખ ₹ 7.50 Lacs	₹ ૩.૦૦ લાખ ₹ 3.00 Lacs	₹ ૭.૫૦ લાખ ₹ 7.50 Lacs
અરજી સાથે ભરવાની રકમ Amount to be paid with Application	₹ ૧૫,૦૦૦/- ₹ 15,000/-	₹ ૧૫,૦૦૦/- ₹ 15,000/-	₹ ૧૫,૦૦૦/- ₹ 15,000/-	₹ ૧૫,૦૦૦/- ₹ 15,000/-	₹ ૭,૫૦૦/- ₹ 7,500/-	₹ ૧૫,૦૦૦/- ₹ 15,000/-
મેન્ટેનન્સ કીપોઝીટ Maintenance Deposit	₹ ૩૫,૦૦૦/- ₹ 35,000/-	₹ ૩૫,૦૦૦/- ₹ 35,000/-	₹ ૩૫,૦૦૦/- ₹ 35,000/-	₹ ૩૫,૦૦૦/- ₹ 35,000/-	₹ ૨૫,૦૦૦/- ₹ 25,000/-	₹ ૩૫,૦૦૦/- ₹ 35,000/-
કોન્ટેક્ટ પર્સનનું નામ/ મો. નંબર Name of Contact Person	શ્રી કે.એન.પટેલ ૯૫૫૮૦૯૪૭૭૧	શ્રી કલ્પેશ ભટ્ટ ૯૪૨૮૭૩૦૮૨૧	શ્રી જે.એન. ગોસ્વામી ૯૮૦૯૮૪૯૫૪૫	શ્રી જી.એસ. પટેલ ૯૫૦૪૦૪૩૭૨૭	શ્રી એન.ટી. ચૌધરી ૯૯૦૯૮૪૯૫૪૫	

EWS Unit Plan



LAY OUT PLAN
GUJARAT HOUSING BOARD AFFORDABLE HOUSING (EWS)
AT:- MAHEMDAVAD, TA. DIST. - KHEDA, GUJARAT

Note : *There can be minor modification in layout with same carpet area and amenities

યોજનાની શરતો / Conditions of the Scheme

૧. મકાનની કુલ કિંમતના ૨૦% રકમ (અરજી સાથે ભરપાઈ કરેલ ડિપોઝીટ બાદ કરતા બાકીની રકમ) દ્વિમાસિક ધર્યા બાદ બે હપ્તોમાં બોર્ડ જણાવે ત્યારે અરજદાર ત્યારબાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ નક્કી કરે તે મુજબના હપ્તોમાં બાકીની ૮૦% રકમ ભરવાની થશે. છેલ્લા હપ્તો સાથે મેન્ટેનન્સ ડિપોઝીટ તથા અન્ય ચાર્જીસ પણ ભરવા પડે. Applicant will have to pay 20% of total cost per unit (less amount paid as application deposit) in two installments when GHB informs they are successful in lots draw. Subsequently they will have to pay the remaining 80% amount in installments as decided by GHB. Installments, maintenance deposit and other charges will also be payable.

૨. અરજદાર અરજીની તારીખે પુખ્ત વયનો હોવો જરૂરી છે. The applicant should be an adult on date of application.

૩. આરક્ષણ Reservation :

વિનિયમો મુજબ આરક્ષિત કેટેગરી માટે મકાનો ફાળવવાની જે મુજબ આરક્ષણ ફાળવવામાં આવેલ છે અને પ્રમાણપત્ર બોર્ડ મંગાવે ત્યારે રજૂ કરવાનું રહેશે.

As per regulations, following is the percentage of category wise reservation and details of certificate to be submitted.

જૂથ Category	ટકાવારી Percentage	પ્રમાણપત્ર આપનાર સ્થાપીશ Details of issuing authority
ડિફેન્સ/Defence	૧૦% (10%)	સેક્રેટરી જીલ્લા સૈનિક બોર્ડ, ગુજરાત Secretary, District Sainik Board, Gujarat
અનુચિત જાતિ/Scheduled Caste	૭% (7%)	ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ આયોગ અધિકારી Officer Of Gujarat State Social Justice Dept.
અનુચિત જાતિ/Scheduled Tribe	૧૪% (14%)	ઉપર મુજબ/As above
બાકી પંચ/Baki Panch	૧૦% (10%)	ઉપર મુજબ/As above
અંધજન/અપંગ (અંધજન અગ્રીમતા)/Blind/Handicap (priority to blind)	૩% (3%)	સિવિલ સર્જન/Civil Surgeon

સમયસર પ્રમાણપત્ર રજૂ ન થાય તો અરજી રદ થવાની થાત છે. આરક્ષિત કેટેગરીમાં પૂરતી અરજી ન આવે તો અન્ય આરક્ષિત કેટેગરીમાં તબદીલ થશે અને તેમાં પણ ન કેટેગરીમાં તબદીલ કરશે. આ બંધનને બોર્ડના નિર્ણય અનુસાર ગણાશે.

If certificate is not submitted in time then application shall be cancelled. If sufficient applications are not received for any reserved category then the lot transferred to other reserved category. If still sufficient applications are not received then the balance shall be transferred to general category. Decision on this matter shall be final.

૪. અરજદારે ફોટો લગાડી અડધી સડી ફોટો ઉપર અને અડધી ફોર્મ ઉપર આવે તેમ સડી કરવાની રહેશે.

Applicant will have to paste photograph on form and sign across in a way that half sign is on form and half on photo.

૫. એક યોજનામાં એક વ્યક્તિ ફક્ત એક જ ફોર્મ ભરી શકશે. પ્રત્યેક યોજના ટીટ તેઓ અલગ અલગ ફોર્મ ભરી શકશે પણ તેઓને દ્વિમાસિક ધર્યા બાદ બે હપ્તોમાં બોર્ડ જણાવે ત્યારે અરજદાર જો સી તે અરજી સાથે ભરેલ રકમ જમ કરી ત્યારબાદ ભરેલ રકમમાંથી ૫૦% રકમ બાદ કરી બાકીની રકમ રીફંડ કરવાની રહેશે. આ રકમ ઉપર વ્યાજ ચુકવવામાં આવશે નહીં.

One person can apply once only in any scheme. They can apply separately for each scheme, but if they succeed in draw in more than one scheme, they choose any one scheme and only one house will be allotted.

૬. મકાનોની ફાળવણી કોમ્પ્યુટર દ્વારા થી કરવામાં આવશે જે બોર્ડના મિલકત ફાળવણીના વિનિયમો અને ધારાધોરણ પ્રમાણે થશે.

Allotment of houses shall be as per lots draw on computer as per Disposal of property regulations of GHB.

૭. મકાનોની કિંમતમાં વધારાની સામગ્રીના ભાવોના વધારા અથવા અન્ય કારણોસર વધારો થાય તો તે અરજદારને બંધનકર્તા રહેશે.

Any increase in cost of houses due to price rise or other external reasons will be binding to the applicant.

૮. આ યોજનામાં ફેરફાર કરવા અથવા મુજબી કરવાનો બોર્ડને અધિકાર હશે.

GHB shall have all rights to modify and/or cancel the housing scheme.

૯. અરજદાર અરજી કર્યા સાથે ભરેલ ડિપોઝીટ રકમ જો તે યોજનામાં ચાલુ રહેવા માન્ય ન હોય તો દ્વિમાસિક ધર્યા બાદ બે હપ્તોમાં બોર્ડ જણાવે ત્યારબાદ સી તે અરજી સાથે ભરેલ રકમ જમ કરી ત્યારબાદ ભરેલ રકમમાંથી ૫૦% રકમ બાદ કરી બાકીની રકમ રીફંડ કરવાની રહેશે. આ રકમ ઉપર વ્યાજ ચુકવવામાં આવશે નહીં.

Applicant can get refund of application money if she/he applies before announcement of draw of the scheme. Thereafter if an applicant who has been successful in lot draw then his application deposit shall stand forfeited and only 50% subsequent amount paid by him shall be refundable. Interest shall not be paid on this amount.

૧૦. અસફળ લાભાર્થીઓને ડિપોઝીટની રકમ દ્વિમાસિક ધર્યા બાદ બે હપ્તોમાં બોર્ડ જણાવે ત્યારે અરજદાર જો સી તે અરજી સાથે ભરેલ રકમ જમ કરી ત્યારબાદ ભરેલ રકમમાંથી ૫૦% રકમ બાદ કરી બાકીની રકમ રીફંડ કરવાની રહેશે. આ રકમ ઉપર વ્યાજ ચુકવવામાં આવશે નહીં.

Unsuccessful applicants shall be refunded the amount of deposit within in a period of 90 days.

૧૧. આ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાન ની ફાળવણી થાય ત્યાં સુધીમાં અરજદારે મકાનની પૂરેપૂરી કિંમત ઉપર અનુ. નં. ૧ માં જણાવ્યા મુજબ ભરપાઈ કરવાની રહેશે. જો તેઓના મકાનો કબજે સોંપવામાં આવશે.

Applicant will have to pay the entire amount as per Sr. No. 1 above after completion of construction and before allotment of house. He will be given only after that.

૧૨. બેંક ચારજ તે જીન મેળવવા બોર્ડ તરફથી જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં આવશે, અને યોજનાવાર બેંકોનું એમ્પ્લોયમેન્ટ કરવામાં આવશે.

GHB shall provide papers for availing loan from bank, and empnal banks for each scheme.

૧૩. મકાનનો કબજો મેળવતા પહેલાં અરજદારે બોર્ડ સાથે કન્વેયન્સ-ડીડ (દસ્તાવેજ) કરવાનો રહેશે, જેનો ખર્ચ પ્રવર્તમાન નિયમાનુસાર અરજદારે ભરવવાનો રહેશે.

Applicant will have to execute conveyance deed with GHB before taking possession of house. Expenses for the same shall be borne by the applicant.

૧૪. સામાજીક અને મકાનનો કબજો સોંપના પહેલાં તમામ સામાજીક અને મકાનની સંસ્થાઓને અસોસીએશન રચવામાં આવશે, જેના હોદ્દાઓએ કોમન સુવિધા જેવી કે પાણી પુરવઠો, ગટર, સીકટ, લીફ્ટો લીડી વિગેરેનો કબજો સંભાળી લેવાના રહેશે. અને સમગ્રી સુવિધાઓ જે બોર્ડના નામે સ્થાનિક સંસ્થામાં નોંધાયેલ હશે તે એસોસીએશનના નામે તબદીલ કરવાની રહેશે અને ત્યારબાદ તેની ચલાવણ/જાળવણી કરવાની રહેશે અને તેને લગતી તમામ ખર્ચાની બેસોસીએશન જવાબદારી રહેશે નહીં.

Before handing over individual possession, Association of all allottees will be formed & Members of that associations has to take over possession of all amenities like water supply, drainage, road, streetlight, lift etc., Then after association have to look after running & maintenance of all amenities & expenses for operating & maintaining the said amenities. GHB will not be responsible for maintenance of Services.

૧૬. બોર્ડ દ્વારા મહાનગર પંચાયત સાથે ચલુ રાખવામાં આવેલા મહેનત-જમીન દિવાનીની કામ કોમન કમ્પાઉન્ડ તબદીલ કરતી વેળાએ જ એસોસિએશનના બાકામાં જમીન હસ્તગતમાં આવશે. જ રકમમાંથી આ સમાનમકરવરગીની ભવિષ્યમાં એસોસિએશન દ્વારા કરવાની રહેશે.
- CHHS shall transfer the amount collected as maintenance deposit from applicant, in the bank account of association at the time of transferring common *assessments*. Association will have to arrange for its operating and maintenance and payment of bills from this amount.
૧૭. બોર્ડની સલાહસૂચકતા મુજબ જ આજીવનકે કરે તથા આવકાસન પ્રવૃત્તિ માટે સંપાદિત જમીન ઉપર કાચે કરવામાં આવેલી સર્વે અરજદાર કામચલાઉ સમય (ઈ. ડબ્લ્યુ. એન્ડ. આર્ટી. ૪૨, ચુકવણી માટે તેમજ વાવેલ વર્ષ (એમ. આર્ટી. ૪૨) બોજામાંથી ની મુક્તિ સુધી મકાન અન્યતઃ તબદીલ કરી શકશે નહીં.
- CHHS scheme is taken up on land assigned for housing at concessional rate, so, applicant shall not transfer his / her house for a period of Seven years (for U. W. S., L. E. S. Scheme) & Five years (for M. L. G. Scheme) from date of possession.
૧૮. આ બોજામાં એન્ડ. આર્ટી. ૪૨ની જમીન ભારતના નાગરિક પણ એ પત્રો ભારતનું સરનામું કામમાં જમીનવાની કરતે અરજ કરી શકશે.
- Non-resident Indians (NRI) who are also Indian Citizens can apply subject to mentioning address of correspondence in India.
૧૯. આવક અને મકાન અંગેનું ખોટું એકિફિટ રજૂ કરનાર સામે કોજારી કાર્યવાહી કરવામાં આવશે.
- Applicant submitting false affidavit of income & house are liable to face criminal proceedings.
૨૦. આ મકાનનો યુનિટ પ્લાન તેમજ ડિઝાઇનમાં ફેરફાર થવાની શક્યતા રહેશે.
- The cost, plan and design of house are subject to change.
૨૧. અરજદારને તરફતાથી લોન મળી રહે તે માટે બોર્ડ દ્વારા ત્રણ બેંકો સાથે સમજૂતી કરેલ છે. આ બેંકો પસંદગી લોન મેળવવા માટે અરજદારે કોઈ લીમિટ વાજે તેમજ આવકસૂચક બોજામાંથી ડ્રેક્યુમેન્ટ આપવાના રહેશે નહીં જે લોન માટેના જરૂરી દસ્તાવેજો બોર્ડ દ્વારા પેકેજે પુરા પાડવામાં આવશે.
- Board has entered in to understanding with 39 banks in order to provide facility of easy loan to applicants. Board will provide all necessary documents to the bank for loan. Applicants will not need to pay any legal charge for this.
૨૨. રાજ્ય સરકારની વખતવાળી નીચુસત તેમજ બોર્ડના મિલકત નિયંત્રણવિનિયમો પ્રમાણે જાહેરે. અવાસની કમ્પાઉન્ડ કરવામાં આવશે.
- Allotment of the houses shall be according to the prevailing guidelines, instructions of state govt. from time to time and as per stipulated of property regulations of Board.
૨૩. અરજદારે સ્વીકૃતિથી વખત તેની વિનયવાર ચકાસણી કરવામાં આવશે તેની અરજદારે નોંધ લેવી.
- Applicant should note at the time of submission of application, their forms will be thoroughly verified.
૨૪. અરજદાર કે તેના પ્રતિજ્ઞાથી કે સર્વોદય વખત બાપડના નામે જે તે શહેરની સલાબાર નિયત કરેલ સહમાં અને સહની આદે નરક આદિ કિંમતો પીરડાના વિસ્તારમાં સરહદો સાથે કે નજરને અડીને કોઈ નગર કે તાલુકામાં આવેલ સ્થળ તાલે શહેર કે નગરની સહોડોડાંસને અને અડીને આવેલ નગર કે વામની હઠ જ્યાં પુલી સીટી હોય તેવા વાટે તરફના કે કિલોમીટરની નિજવામાં વિસ્તારમાં વાવેલો કે આગળ પુલીડી પ્રાથમિક મેળવેલ મકાન કે જમીનનો પ્લોટ હોયો જોઈએ નહીં.
- Applicant or Husband / Wife or major child should not have house or plot of land in a radius of 8 km of related city and if there is any village town / city adjoining than there should not be any house / plot of land in a radius of 8 km of the adjoining village / town / city.

અરજીપત્રક ભરવાની માર્ગદર્શિકા / Directions for filling Application Form

- કોટક અરજીપત્ર ૩ તેની નીચેનારિતિ ઉપર મુજબની ફક્ત આ સાથે જજાવેલ કોટક મહેન્દ્ર બેન્કની તમામ શાખાઓ તથા બેન્કની શાખો દ્વારા દિવાલ અન્ય સ્થળોથી મેળવી શકે, બેન્કનો ચાલુ દિવસે બેન્કનો કાર્યકાળ કાર્યકાલ દરમિયાન મેળવી શકે, બેન્કની કોઈપણ કમેટી અથવા અન્ય સ્થળોથી મળેશે નહિ.
- Blank application forms shall be sold at the designated price at all locations of Kotak Mahindra Bank mentioned herein during banking hours on bank working days. Blank application forms shall not be available from GHB offices or any other places.
2. અરજીપત્ર તથા માહિતી પત્રિકાઓ સંપૂર્ણ અભ્યાસ કરી ભરેલ અરજીપત્ર તથા સાથે ભરવાની રકમ આર.ટી.જી. એસ. નેટ બેંકીંગ/ડી.ડી. પે ઓર્ડરથી જાણીત અવરજાપત્ર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ/રાજકોટ/સુરત/વડોદરા કોટક મહેન્દ્ર બેંકના ખાતામાં કમ્પાઉન્ગ દિવસે તથા સમયે ભરવાના રહેશે.
- After studying carefully the application form and Brochure, the filled up form is to be submitted along with application deposit amount by RTGS/Net Banking/D/D/Pay order in Account of Estate Manager, Gujarat Housing Board at Ahmedabad/Rajkot/Surat/Vadodara, whichever applicable at Kotak Mahindra Bank during banking hours on bank working days.
3. એક્ટ્રિવિટ સહિતના દસ્તાવેજો શક્ય તરતજ વહેલા અને મોઢમાં મોઢા ઢો સમયે રજૂ કરવાના રહેશે અનથવા અરજીપત્રક રદ કરવામાં આવશે.
- Submission of Documents including affidavit should be done at the earliest. They should be submitted latest at the time of the draw. Otherwise application will be rejected.
4. અરજદાર પોલી માહિતી આપેલ હશે, અનથવા તો જો કોઈ સમ કસીત છુપાવેલ માહુમ પડશે તો તેઓનાસથે કોઈપણ જાતનોપત્રવ્યવહાર ક્યાં સિવાયતેઓનીઅરજી આપોઆપ રદ થશે અને પોજનામાં કાર્યવાહીનો તેઓની કોઈ હક્ક રહેશે નહીં. તેમજ ભરેલ ડીપોઝિટ પૂરેપૂરી જપ્ત કરવામાં આવશે અને અરજદાર સામે ખોટી ફારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
- If applicant has given wrong information or has not revealed any facts, then his application shall automatically stand forfeited and he/she shall have no right for allotment in the scheme and Board will take legal action against applicant.
5. અરજદાર કોટક ઢોમાં સફળ થાય તેથી મકાન કાઢવણી અને તેઓનાહક્ક થતો નથી, પરંતુ પોર્ટાના આ અનેનાવિનિયમો અનુસાર અવિફૂલ હશે અને જરૂરી આડી રકમ નાણેલ મુદતમાં ભરે હશે તો જ તેઓનીઅરજી મકાન કાઢવણી માટે વિચારવામાં આવશે.
- More success in lot draw does not entitle the applicant for allotment. But if he/she qualifies as per regulations of GHB and has paid the necessary amounts in prescriptive time limit, then only his application will be considered for allotment.
6. અરજીપત્રક ગુજરાત હાઉસિંગ બોર્ડ/કોટક મહેન્દ્ર બેન્ક દ્વારા મોકલાયેલે નહીં અથવા સ્વીકારાશે નહીં, તેમજ સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ રદ બજાશે.
- Application forms shall not be sent or received by post either by GHB or Kotak Mahindra Bank. Application forms received after due date shall be cancelled.
7. ઓનલાઈન ફોર્મ તથા ઓનલાઈન નાણાં ભરનારને ડેવોની રસીદ પોત જ ઓનલાઈન પ્રિન્ટ કરી લેવાની રહેશે. જેમાં તેમનો યુનિક આઈ. ડી. નં. જજાવેલ હશે. (વેબસાઈટ : www.gujarathousingboard.org)
- Applicants applying online and making online payment will have to get the online print of the receipt themselves in which their Unique Id No. shall be mentioned (website : www.gujarathousingboard.org).
8. અરજદારને અરજીપત્રકમાં જજાવેલ ખોળાઈલ નંબર ઉપર ફોર્મ મળ્યાની, નાણાં મળ્યાની તથા કોમ્પ્યુટર ઢોમાં સફળ થવાની જજાવણી શક્ય હશે તો એસ. એમ. એસ. થી મોકલવામાં આવશે.
- If possible the information regarding receipt of form, receipt of payment and success in draw shall be sent to applicant by SMS on mobile number mentioned in application form.
9. અરજીપત્રક મેળવવાની તથા ભરવાની તારીખ ૨૦૧૫-૨૦૧૬ થી ૨૦૧૬-૨૦૧૭ રહેશે. ત્યારબાદ કોઈ અરજીપત્રક કે વિનંતીપત્ર સ્વીકારવામાં આવશે નહીં.
- Date for obtaining and submitting application form shall be 23-5-2016 to 24-6-2016. Subsequently, no application shall be accepted.